



પ્રાથમિક સારવાર

આવશ્યક જીવન કૌશલ્ય

“રેડ ક્રોસ ભવન” જુના વાડજ સર્કલ, અમદાવાદ-૩૮૦૦૧૩

ફોન : ૦૭૯-૨૭૫૪૭૦૫૫/૫૬, ૦૭૯-૨૭૫૪૮૨૩૦

Email : ircsguj@hotmail.com • Web : www.redcrossgujarat.org



બીજુ આવૃત્તિ
ઓક્ટોબર ૨૦૨૩

પ્રતા: ૪૦૦૦

કિંમત : રૂ. ૧૧૦/-

પ્રાપ્તિ સ્થાન :
ઈન્ડીયન રેડ કોસ સોસાયટી
ગુજરાત રાજ્ય શાખા
રેડ કોસ ભવન, જુના વાડજ સર્કલ,
અમદાવાદ-૩૮૦૦૧૩
ફોન : ૦૭૯-૨૭૫૫૭૦૫૫, ૦૭૯૨૭૫૫૭૦૫૬
Email : ircsguj@hotmail.com
Web : www.redcrossgujarat.org

કુદરતી કે માનવસર્જિત આપતિ સમયે અસરગ્રસ્ત લોકોને સ્થાનિક અને આસપાસના લોકો જ પ્રથમ મદ્દ કરે છે. બહારની તાલીમબદ્ધ એજન્સીઓ પહોંચતા સમય લાગતો હોય છે. છેલ્લી ઘણી આપતિઓના અનુભવે જણાયું છે કે, સ્થાનિક સ્તરે બચાવ અને સારવાર યોગ્ય રીતે નથી મળતા. આપતિની ઘટનાના શરૂઆતના ૧ થી ૨ કલાકનો સમયગાળો લોકોને બચાવવા માટે ઘણો મહિત્વનો હોય છે, આ દરમિયાન બચાવની યોગ્ય કામગીરી ન થાય તો જાનહાનિ વધી શકે છે. મોટી આફ્ટોમાં અસરગ્રસ્ત સમૃદ્ધાય ભયભીત અને ગાભરાયેલો હોય છે. આ સ્થિતિમાં સ્થાનિક સ્તરે તાલીમબદ્ધ વ્યક્તિ હોય તો શરૂઆતના કલાકોમાં બચાવ અને પ્રાથમિક સારવાર દ્વારા જાનહાનિ ઘટાડી શકાય છે. પરંતુ આ કામગીરી કરવા માટે સ્થાનિક વ્યક્તિઓમાં જાણકારી, કૌશલ્ય અને સજ્જતા હોવી અનિવાર્ય છે.

આ પરિપેક્ષમાં ઈન્ડીયન ડેડ કોસ સોસાયટી, ગુજરાત રાજ્ય શાખા દ્વારા પ્રાથમિક સારવાર તાલીમ કાર્યક્રમ

નિયમિત રીતે ચલાવવામાં આવે છે. આ પુસ્તિકામાં વારંવાર ૧૦૮ ને ફોન કરવા સુયવ્યુ છે કેમ કે, આપણા ચાજ્યમાં આ સેવા ઉપલબ્ધ અને પ્રયલિત છે. પરંતુ ઈમરજન્સીમાં કોઈપણ એમ્બ્યુલન્સ બોલાવવી અથવા ઈજાગ્રસ્તને કોઈપણ વાહન દ્વારા સત્યરે હોસ્પિટલે પહોંચાડવા આવશ્યક છે.

પુસ્તિકામાં આવરી લેવાયેલ વિગતો પ્રાથમિક છે. જેના માટે વ્યક્તિએ ઓછામાં ઓછા ૧૬ કલાક તાલીમ લેવી ફરજીયાત છે એટલે કે આ પુસ્તિકા ફક્ત અને ફક્ત ઈન્ડીયન રેડ ક્રોસ સોસાયટી, ગુજરાત રાજ્ય શાખા તેમજ તેમના દ્વારા સંચાલિત કેન્દ્રો પર ચલાવવામાં આવતા પ્રાથમિક સારવારનાં વર્ગો ના તાલિમાર્થીઓ માટે તેમજ સંસ્થાનાં સ્વયંસેવકો માટે સંદર્ભ તરીકે છે.

વિષયો

પેજ નં.

૧. પ્રાથમિક સારવારની રૂપરેખા	૫
૨. બેભાનાવસ્થા અને શ્વાસોચ્છવાસ	૧૨
૩. બેભાનાવસ્થા અને શ્વાસ બંધ – સીપીઆર	૧૬
૪. ચોકિંગ (ગળામાં કંઈક ફ્સાઈ જવું)	૨૬
૫. હાર્ટ એટેક	૨૮
૬. સ્ટ્રોક	૩૩
૭. રક્તસત્રાવ	૩૭
૮. પાટા અને પહૂણી બાંધવાની રીતો	૪૨
૯. અસ્થીભંગ-ફેક્ચર	૫૪
૧૦. માથાની ઈજા	૫૮
૧૧. દાગવુ	૬૨
૧૨. અસ્થમા (દમ)	૬૬
૧૩. ડાયાબિટીસ ઈમરજન્સી	૭૦
૧૪. તણાવ	૭૪


વિષયો

પેજ નં.

૧૫. ઝેર	૭૬
૧૬. મચકોડ / સનાયુઅનું ખેંચાણ	૭૮
૧૭. પ્રાથમિક સારવારની પેટી	૮૨
૧૮. માનવશરીર રચના અને તેના કાર્યો	૮૬

૧. પ્રાથમિક સારવારની રૂપરેખા

વ્યક્તિ ઓચિંતો બિમાર પડે કે ઘાયલ થાય ત્યાંથી તેને યોગ્ય તબીબી સારવાર સુધી પહોંચાડતા સુધીમાં કે ૧૦૮ એમ્બ્યુલન્સ આવતા સુધીમાં તાલીમ પામેલા વ્યક્તિ દ્વારા જે કંઈ સાચી સારવાર કે મદદ કરવામાં આવે તેને પ્રાથમિક સારવાર કહે છે.



તાલિમ પામેલ વ્યક્તિ એટલે માન્ય સંસ્થા દ્વારા યોગ્ય રીતે તાલિમ પામેલો વ્યક્તિ કે જે અક્ષમાત કે.

માંદગીનાં સંજોગોમાં પ્રાથમિક સારવાર આપી શકે.
ઇન્ડીયન ડેડ કોસ સોસાયટી સમગ્ર દેશમાં ગુણવત્તા સાથે
તાલીમ આપી જનસમૃદ્ધાયનાં લોકોને પ્રાથમિક મદદ
કરનાર તરીકે તૈયાર કરવામાં માન્યતા પ્રાપ્ત સંસ્થા છે.

પ્રાથમિક સારવારનો હેતુ

- 👉 વ્યક્તિનું જીવન બચાવવું.
- 👉 વ્યક્તિની હાલત વધારે ખરાબ થતી અટકાવવી
- 👉 વ્યક્તિની હાલતમાં સુધારો લાવવા મદદરૂપ થવું.
- 👉 વ્યક્તિને ઝડપથી યોગ્ય તબીબી સારવાર માટે રીફર
કરવો (૧૦૮ નંબર પર ફોન કરી એમ્બ્યુલન્સ બોલાવવી)

પ્રાથમિક સારવારનું કાર્યક્ષેત્ર

૧. તપાસવું : બનાવની વિગત મેળવવી તેમજ ચિનહો,
નિશાનીઓ અને લક્ષણો તપાસવા.
૨. સારવાર કરવી : દર્દીની જરૂરિયાત મુજબ પ્રાથમિક
સારવારની મર્યાદામાં રહી તેને પ્રાથમિક સારવાર
આપવી.

૩. વ્યવસ્થા : પ્રાથમિક સારવારનું અંતિમ દ્યેય હંમેશા વ્યક્તિને યોગ્ય અને ઝડપથી તબીબી સારવાર કરવા માટે ખસેડવો તે રહેલું છે. જેમાં ત્વરીત રીતે ૧૦૮ અથવા અન્ય એમ્બ્યુલન્સ બોલાવવી એ મુખ્ય બાબત રહેલી છે.

પ્રાથમિક સારવારનાં સોનેરી નિયમો :-

૧. બનાવ સ્થળે ત્વરીત પહોંચો. ઝડપથી અને સમયસરની સારવાર વ્યક્તિનું જીવનબચાવવામાં મહત્વનો ભાગ ભજવે છે.
૨. શાંતિ અને ધિરજતાથી કાર્ય કરો. જરૂર કરતા વધારે કરવાની કોશીષ કરવી નહીં, યાદ રાખો પ્રાથમિક મદદ કરનાર ડોક્ટર નથી.
૩. નીચેની બાબતો ખાસ તપાસો
 - 👉 શું વ્યક્તિનાં શ્યાસોરછવાસ ચાલુ છે ?
 - 👉 શું વ્યક્તિને તીવ્ર બાહ્ય રક્તસ્ત્રાવ થાય છે ?
 - 👉 શું વ્યક્તિનું હૃદય બરાબર ધંબકે છે ?

- a. જો વ્યક્તિનાં શ્યાસોચ્છવાસ બંધ હોય તો તુર્ટંતજ કુશ્મિન શ્યાસોચ્છવાસ આપવાની શરૂઆત કરો. યાદ રાખો અહિંચા એક-એક સેકન્ડ કિંમતી છે.
- b. બાહ્ય રક્તસ્ત્રાવનાં કિસ્સામાં તુર્ટંતજ સ્વર્ચ કપડા વડે ઓછામાં ઓછા ત્રણ મિનીટ સુધી બાહ્ય દબાણ આપો.
- c. આધાતની સારવાર આપો.
- d. ઘાયલ વ્યક્તિને જરૂર કરતા વધારે મદદ કરવાની કોશીષ કરવી નહીં યાદ રાખો તમે ડોક્ટર નથી.

૪. જો ઉપલબ્ધ હોય તો પ્રાથમિક સારવારની પેટીનો ઉપયોગ કરો. આસપાસમાં રહેલી વસ્તુઓનો પણ ચોગય રીતે ઉપયોગ કરી શકાય.

૫. બનાવનાં સ્થળને બરાબર ચકાસો. જો વ્યક્તિ ઈલેક્ટ્રીક જીવતા વાયર, મકાનનાં કાટમાળ, આગા, ગેસ ગળતર વગેરેમાં ફસાયો હોય તો તુર્ટંત જ તેમને સલામત સ્થળે ખસેડો.

૬. વ્યક્તિને સાંત્વના આપો કે જેથી વ્યક્તિની હાલત સુધાર લાવવામાં મદદરૂપ થઈ શકાય.
૭. તાત્કાલિક રીતે વ્યક્તિને યોગ્ય તબીબી સારવાર માટે ખસેડવાની શરૂઆત કરો સાથે સાથે તેમના નજીકનાં સંબંધીને સ્થિતીથી માહિતગાર કરો.
૮. તમારા કાર્યને પ્રાથમિક સારવાર પુરતું જ મર્યાદિત રાખો.
૯. લોકોને દર્દીની આસપાસ ભેગા થવા દેવા નહીં. તેમજ દર્દીની ચીંતા ઓછી કરવાનાં પ્રયત્નો કરવા.
૧૦. દર્દીના કપડા જરૂર વગાર કાઢવા નહીં.
૧૧. દર્દીને યોગ્ય તબીબી સારવાર માટે ઝડપથી રીફર કરવાની વ્યવસ્થા કરવી.

પ્રાથમિક મદદ કરનારની મુખ્ય જવાબદારીઓ

- 👉 પરિસ્થિતીની તપાસ
- 👉 સ્થિતીનું યોગ્ય નિદાન
- 👉 જરૂરી અને યોગ્ય મદદ
- 👉 એકથી વધુ જગ્યાએ અથવા વધુ પ્રકારની ઈજામાં સારવારમાં યોગ્ય પ્રાથમિકતા
- 👉 અક્ષમાતની ગંભીરતા આધારિત યોગ્ય જગ્યાએ વ્યક્તિને ત્વરિત પહોંચાડવો.

યોગ્ય તબીબી લાયકાત ધરાવતો વ્યક્તિ અથવા ઈમરજન્સી એમ્બ્યુલન્સ ના આવતા જ પ્રાથમિક મદદ કરનારની જવાબદારી પુરી થાય છે. પ્રાથમિક મદદ કરનારે વ્યક્તિને યોગ્ય તબીબી મદદ સુધી સંભાળ લેવી જરૂરી બની રહે છે.

પ્રાથમિક સારવારનાં સર્ટીફીકેટ ની મુદ્દત ત્રણ વર્ષ સુધીની હોય છે. ત્યારબાદ વ્યક્તિને ચીન્યુઅલ સર્ટીફીકેટ આપવામાં આવે છે જો વ્યક્તિ :

- 👉 યોગ્ય તાલિમ પામેલ હોય
- 👉 નિયમિત પરીક્ષા આપતો હોય

👉 દરેક નવા જ્ઞાન અને માહિતી ને આત્મસાત કરી તેનો ઉપયોગ કરતો હોય.

કુદરતી અથવા માનવસર્જૂત આફત પછી નીચેની અવસ્થામાં પ્રાથમિક સારવારની જરૂરિયાત ખુબજ આવશ્યક બની રહે છે.

- 👉 બેભાનાવસ્થા
- 👉 શ્વાસોચ્છવાસ અને હૃદયનું બંધ થઈ જવું.
- 👉 તીવ્ર બાહ્ય તેમજ આંતરિક રક્તસત્રાવ
- 👉 આધાત
- 👉 ચક્કર આવવા
- 👉 અસ્થિભંગ
- 👉 માથાની ઈજાઓ
- 👉 મળાકા તેમજ કરોડરજ્જુની ઈજાઓ

૨. બેભાનાવસ્થા (શ્વાસોચ્છવાસ ચાલુ હોય તો)


૧. વ્યક્તિનું માથું પાછળ નમાવી તેના
શ્વાસોચ્છવાસને જુઓ અને મહેસુસ કરો.

જ્યારે વ્યક્તિ બેભાન હોય છે
ત્યારે તેનાં સ્નાયુઓમાં
ટીલાશ આવવાથી વ્યક્તિની
જુખ પાછળનાં ભાગમાં નમે
છે અને શ્વાસમાર્ગ બંધ થઈ
જાય છે અને વ્યક્તિ
શ્વાસોચ્છવાસની કીયા કરી
શકતો નથી. તેમનું માથું પાછળનાં ભાગે નમાવવાથી
તેનો શ્વાસમાર્ગ કલીયર થાય છે. તેમની છાતી અને પેટનું
હલન-ચલન નીહાળવાથી શ્વાસોચ્છવાસની કીયાની
ખાતરી થઈ શકે છે.



૨. વ્યક્તિને કોઈ એક પડખે સુવડાવો અને માથું પાછળનાં
ભાગે નમાવો.

Cardiopulmonary Resuscitation (CPR)



આ રીતે સુવડાવવાથી વ્યક્તિની
જુબ આગળ ભાગોજ નમેલી
રહે છે તેમજ ઉલ્ટી કે લોહી
મો મા ના રહેતા બહાર નીકળી
જાય છે

૩. જલ્દીથી ૧૦૮ ને ફોન કરો અથવા અન્યને આમ
કરવા કહો.

**પ્રશ્ન-૧ જો કોઈ શીશુ બેભાન હોય અને શાસોચ્છવાસ લેતું
હોય તો શું કરી શકાય ?**

તેને રિકવરી પોર્ઝિશનમાં સુવડાવો અને ૧૦૮ ને ફોન કરવો
અથવા અન્યને આમ કરવા કહેવું.

પ્રશ્ન-૨ વ્યક્તિનાં શાસોચ્છવાસ તપાસવા માટે માથું શા માટે પાછળ નમાવવું જોઈએ ?

જ્યારે વ્યક્તિ બેભાન હોય ત્યારે તેની જુબ પાછળ નમેલી હોવાથી શાસમાર્ગ બંધ કરી દે છે. તેનું માથું પાછળ નમાવવાથી તે કલીયર થાય છે.

પ્રશ્ન-૩ જો વ્યક્તિ ને પીઠમાં કે ગળામાં ઈજા હોય તો પણ આમ કરવું સલાહ ભરેલું છે ?

જો આવી શંકા હોયતો, તેને એક પડખે આખુ શરીર વળે નહીં તે રીતે સુવડાવો જેમાં અન્ય વ્યક્તિઓની મદદ લઈ શકાય. આમ કરતી વખતે કરોડરજ્જુ સીધી રેખામાં રહે તે ખુબ જ આવશ્યક છે.

પ્રશ્ન-૪ શાસોચ્છવાસને કઈ રીતે જોઈ તેમજ અનુભવી શકાય ?

માથું પાછળનાં ભાગમાં નમાવ્યા પછી તેની છાતીનું હલન-ચલન નિહાળો. તમે તેના શાસોચ્છવાસ તમારા ગાલ પર મહેસુસ પણ કરી શકો.

**પ્રશ્ન-૫ જ્યારે વ્યક્તિને એક પડખે સુવડાવીને તેનું માથું
પાછળનાં ભાગમાં નમાવીએ તેને રીકવરી પોઝિશન
કહેવાય છે?**

હા

**પ્રશ્ન-૬ શું વ્યક્તિને વાતચીત કરાવવાનો પ્રયત્ન કરવો
જોઈએ ?**

હા, વ્યક્તિને આશ્વાસન આપો. જો તે પ્રતિભાવ ના આપે
તો પણ કદાચ સાંભળતો હોઈ શકે.

પ્રશ્ન-૭ જે વ્યક્તિને ચક્કર આવે તો શું કરી શકાય ?

જે વ્યક્તિને ચક્કર આવે તો, તેને સપાઠી પર ચતો
સુવડાવી તેના પગ ઇંગ્રી પર ઉંચા કરી દો. આમ
કરવાથી તેના મગજને પુરતો લોહીનો જથ્થો મળી રહે છે.
આવી વ્યક્તિ ગડપથી ભાનમાં આવી જતી હોય છે જે
આમ ન થાય તો તેને બેભાન પ્રમાણે પ્રાથમિક સારવાર
આપવી.



3. બેભાનાવસ્થા આને શ્વાસ બંધ - સીપીઆર

👉 બેભાનવસ્થાની ખાતરી



👉 શ્વાસોચ્છવાસ ચાલુ છે કે બંધ તેની ખાતરી (માથું પાછળનાં ભાગમાં નમાવી શ્વાસોચ્છવાસને જુઓ અને મહેસુસ કરો)



જ્યારે વ્યક્તિ બેભાન હોય છે ત્યારે, સ્નાયુઓમાં ટીલાશને લીધે જુબ પાછળનાં ભાગમાં નમી જાય છે અને શ્વાસમાર્ગ બંધ કરી દે છે. તેનું માથું પાછળ લઈ જવાથી જુબ થોડી આગળ નમે છે અને શ્વાસમાર્ગ ખુલ્લો થાય છે.

પેટનાં હલન-ચલન તેમજ ગાલ પર મહેસુસ કરવાથી
પણ શ્વાસોચ્છવાસની કીયા ચાલુ છે કે બંધ
તેનો ઘ્યાલ આવે છે.

- 👉 ઝડપથી ૧૦૮ ને ફોન કરો અથવા અન્યને આમ
કરવા કહો
- 👉 છાતીનાં વચ્ચેના ભાગમાં દબાણ આપો અને પાછુ
રિલીઝ કરો, જેને સીપીઆર કહે છે. આનાથી
હૃદય શરીરનાં અગાત્યનાં અવયવોને લોહી
પહોંચાડવાનું કામ ચાલું રાખે છે જેથી મગાજ
જેવા અગાત્યનાં અવયવો ચાલુ રહે છે.



👉 મદદ આવતા સુધી માં એક મિનીટમાં ૧૦૦ વખત દબાણ એમ સી.પી.આર. આપવાનું ચાલુ રાખો.

પ્રશ્ન-૧ શીશુ અને બાળકનાં કિસ્સામાં છાતી પર દબાણ આપવાની પદ્ધતી જુદી હોય છે ?

પ્રકીયા સરખીજ હોય છે પરંતુ શિશુ અને બાળકોનાં કિસ્સામાં થોડો તફાવત દબાણ આપવામાં રહેલો છે. ૦ થી ૧ વર્ષનાં બાળક માટે ફક્ત બે અંગળાનો ઉપયોગ કરવો જ્યારે ૧ વર્ષથી તરફાવરથા સુધી નાં બાળકમાં એક હાથનો ઉપયોગ કરવો.



પ્રશ્ન-૨ શ્યાસોચ્છવાસ તપાસવા માટે વ્યક્તિનું માથું પાછળનાં ભાગો શા માટે નમાવવું જોઈએ ?

જ્યારે વ્યક્તિ બેભાન હોય છે ત્યારે તેની જુભ પાછળ નમેલી હોવાથી શાસ માર્ગ બંધ કરી દે છે. તેનું માથું પાછળ નમાવવાથી તે કલીયાર થાય છે.

પ્રશ્ન-૩ શાસોચ્છવાસ ને કઈ રીતે જોઈ તેમજ અનુભવી શકાય?

માથું પાછળનાં ભાગમાં નમાવ્યા પછી તેની છાતીનું છલન-ચલન નિહાળો. તેમના શાસોચ્છવાસ ને તમારા ગાલ પર મહેસુસ કરો તેમજ કાન વડે સાંભળો.

પ્રશ્ન-૪ છાતી પરનું દબાણ શું છે ?

છાતી પરનું દબાણ એટલે બે હાથને છાતીનાં બરોબર મદ્ય ભાગમાં રાખી સતત દબાણ આપવું અને રીલિઝ કરવું કે જેથી લોહીનું છુદ્યમાંથી શરીર માં પરીપ્રભણ થાય.

પ્રશ્ન-૫ છાતી પર દબાણ કેટલો સમય આપવું જોઈએ ?

વ્યક્તિને તબિબી સારવાર મળતા સુધીમાં અથવા ૧૦૮ એમ્યુલન્સ આવતા સુધીમાં આ દબાણ

આપવાની કીયા ચાલુ રાખવી જોઈએ. જો બીજુ કોઈ વ્યક્તિ મદદ કરી શકે તેમ હોય તો વારા-ફરતી વચ્ચે અટક્યા વગર આ કીયા કરી શકાય.

પ્રશ્ન-૬ શું આમ કરવા જતા વ્યક્તિની પાંસળી તુટી શકે છે ?

કદાચ, પરંતુ આ બાબતમાં ચિંતા કરવી નહીં. યાદ રાખો શરીરમાં લોહીનું પરિભ્રમણ કરાવવું એ આપણી પ્રાથમિકતા છે. તુટેલી પાંસળી ફરીથી સાજુ કરી શકાશે પરંતુ છાતી પરના દબાણનાં અભાવે લોહીનું પરિભ્રમણ ન થાવાથી વ્યક્તિનાં બચવાની તકો ખુબજ ઓછી થઈ જાય છે.

પ્રશ્ન-૭ જો કોઈ વ્યક્તિ બેભાન હોય અને શાસોછ્ઘવાસ બંધ હોય અને તમે એકલાજ મદદ કરનાર હોય ત્યારે શું કરી શકાય ?

જો તમે એકલા હોવ તો, છાતી પર દબાણ આપતા પહેલા ૧૦૮ એમ્બ્યુલન્સ ને ફોન કરો.

**પ્રશ્ન-૮ જે વ્યક્તિનાં શ્વાસોચ્છવાસ ચાલુ છે છતા આપણે
છાતી પર દબાણ આપવાની ભુલ કરીએ તો ?**

પ્રાથમિક સારવારમાં સીપીઆર આપવાની આ સાચી
પદ્ધતિ નથી, પરંતુ આવી ભુલ ન થાય તેની અવશ્ય
કાળજી રાખવી.

**પ્રશ્ન-૯ શું આપણે મો થી મો વાટે શ્વાસોચ્છવાસ આપી
શકીએ ?**

જે તમે આમ કરી શકો તો ચોક્કસ આપવા જોઈએ.
જેમાં છાતીનાં દબાણ સાથે મો અથવા નાકમાં શ્વાસ
આપવામાં આવે છે. છતા પણ છાતીનાં દબાણને
પ્રાથમિકતા આપવી એ અગત્યની બાબત છે કારણ કે
વ્યક્તિનાં લોહીમાં થોડો ઓક્સિજન ભરેલો હોય છે
અને દબાણ આપવાથી તે ઓક્સિજન ને લોહી વાટે
મગજ સુધી પહોંચાડી શકાય છે. મોથી મો વાટે શ્વાસ
આપવાથી ઓક્સિજનનો ફેફસામાં સંચાર થાય છે. ૩૦
વખત છાતી પર ચોગય જગ્યાએ દબાણ અને ૨ વખત
મો થી મો અથવા નાક વાટે શ્વાસોચ્છવાસ આપવા

એને સીપીઆર (કાર્ડીયો પલ્ઝોનરી રીસસિટેશન) કહેવાય છે.

પ્રશ્ન-૧૦ મો થી મો વાટે શ્વાસોચ્છવાસ કઈ રીતે આપી શકાય ?

જો આપ કરી શકો તો, ૩૦ વખત છાતી પર દબાણ આચ્ચા પછી, મો થી માં અથવા નાક વાટે બે શ્વાસ આપી શકાય. આપનું મો દર્દીનાં મો અથવા નાક પર બરોબર ગોઠવી તેમાં બે વખત ઉંડા શ્વાસ આપો. જો ૦ થી ૧ વર્ષની ઉંમરનું શીશુ હોય તો, તેને તમારા મો થી તેમના મો અને નાક એમ બન્ધે માં શ્વાસોચ્છવાસ આપવા કારણકે તેમનો ચહેરો ખુબજ નાનો હોય છે.



પ્રશ્ન-૧૧ આપણા દ્વારા છાતી પર દબાણ આપવાથી વ્યક્તિનું બંધ હૃદય ફરી ચાલુ થઈ શકે છે ?

છાતી પર દબાણ આપવાથી હૃદય ફરીથી શરૂ થવાની ખુબજ ઓછી શક્યતા રહેલી છે. હૃદયને ફરીથી શરૂ કરવા માટે સામાન્ય રીતે ડીફ્બિલેટર દ્વારા ઈલેક્ટ્રોિક શોક આપવો ખુબ જ જરૂરી છે. છાતી પર દબાણ આપવાથી મગજને લોહીનાં જથ્થા વાટે આક્સિજન મળતો રહે છે અને મગજ જીવીત રહે છે. આમ કરવાથી તમે વ્યક્તિનાં શરીરમાં કોઇ દીખીતો તફાવત જોશો નહીં પરંતુ છાતી પર દબાણ આપવાનું છોડવું નહીં. છાતી પરનું દબાણ જ વ્યક્તિનાં મગજને જીવીત રાખે છે જે અને આને લીધેજ પાછળથી આપવામાં આવતી તબીબી સારવાર વડે વ્યક્તિ બચી શકે છે.

પ્રશ્ન-૧૨ ડીફ્બિલેટર ?

ઓટોમેટેડ એક્સટરનલ ડીફ્બિલેટર (automated external defibrillator (AED)) એ એક હૃદયને ઈલેક્ટ્રોિકલ શોક આપી તેની મુજાહીમમાં લાવવા માટેનું સાધન છે. એક વખત આ મશીન શરૂ કર્યા પછી તે જાતેજ આપણે શું કરવું તે માહિતી આપતું રહે છે.



પ્રશ્ન-૧૩ શું આપણે ડીફીબ્રિલેટર વાપરી શકીએ ?

હા, આપણે ઓટોમેટેડ એક્સટર્નાલ ડીફીબ્રિલેટર (automated external defibrillator (AED)) નો ઉપયોગ ચોક્કસ કરી શકીએ. આજકાલ ઘણા જાહેર સ્થળો જેવાકે, રેલ્વે સ્ટેશન, એર પોર્ટ, ઇન્ટરનેશનલ એરલાઇન્સ, શોપીંગ મોલ વગેરે સ્થળોએ આવા ડીફીબ્રિલેટર રાખવામાં આવે છે. જો જરૂર નહીં હોય તો યંત્ર માણસને જાતેજ શોક નહીં આપે એટલે એમ નહીં સમજવું કે માણસનું હૃદય ફરી ચાલુ નહીં થાય.

પ્રશ્ન-૧૪ જો કોઈ વ્યક્તિ અક્ષમાતે પાણીમાં કુબી ગયો હોય અને જેભાન અવસ્થામાં શ્વોચ્છવાસ ચાલુ ન હોય તો શું કરી શકાય ?

વ्यक्तिने કોઈપણ પ્રકારનાં વિલંબ વગાર સુકી જમીન પર લઈ આવો અને તેનું કપાળ થોડું પાછળના ભાગમાં નમાવી શાસોચ્છવાસ ચાલુ છે કે બંધ તેની ખાતરી કરો. જો વ્યક્તિ બેભાન હોય અને શાસોચ્છવાસ બંધ હોય તો છાતી પર દબાણ (CPR) આપવાનું ચાલુ કરો.

ડુબવાનાં કિસ્સામાં મોં થી મોં અથવા નાક વાટે શાસોચ્છવાસ આપવા એટલા જ જરૂરી છે. આમ ત્રીસ વખત દબાણ અને ૨ વખત શાસોચ્છવાસ આપવાની શરૂઆત કરો. તબીબી સારવાર મળતા સુધીમાં અથવા ૧૦૮ એમ્બ્યુલન્સ આવતા સુધીમાં આ પ્રકીયા ચાલુ રાખો.

૪. ચોકિંગ (ગળામાં કંઈક ફ્સાઈ જવું)



☞ વ્યક્તિ ને પાછળના ભાગમાં ખભાની બજે પ્લેટ વચ્ચે હથેળી થી થઘા લગાવો કે જેથી ફ્સાયેલી વસ્તુ બહાર આવી જાય

આનાથી શ્વાસનળીમાં તીવ્ર વ્હલન-ચલન અને દબાણ આવે છે જે ફ્સાયેલી વસ્તુને બહાર ધકેલવા માટે પુરતુ છે આમ ફ્સાયેલી વસ્તુ બહાર નીકળી જવાથી વ્યક્તિ ફરીથી શ્વાસોચ્છવાસ લેતો થાય છે. જરૂર જણાય તો ૧૦૮ ને ફોન કરો અથવા અન્ય ને આમ કરવા કહો.

પ્રશ્ન-૧ જો પાછળના ભાગમાં થઘા લગાવવાથી વસ્તુ બહાર ન નીકળે તો શું કરવું ?

જો પાંચ થઘા પાછળનાં ભાગમાં લગાવવાથી પણ વસ્તુ બહાર ન નીકળે તો વ્યક્તિની પાછળ ઉભા રહી, બે

હાથની મુશ્કી વાળી વ્યક્તિનાં પેટથી ઉપરના ભાગમાં ઉપર-અંદર રીતે તીવ્ર દબાણ આપે. આ રીતે પાંચ વખત કરો. આ કિયાને “હેમલીક મેનુવર” અથવા એઝોમીનલ થ્રસ્ટ કરે છે. એક વર્ષથી નીચેના બાળક માટે આમ કરવું હિતાવહ નહીં.


પ્રશ્ન-૨ શું બાળક અને પુખ્ત વચ્ચની વ્યક્તિનાં કિસ્સામાં ચોકિંગની પ્રાથમિક સારવાર જુદી હોઈ શકે છે ?

ના બાળકો અને પુખ્ત વચ્ચનાં વ્યક્તિમાં એક સરખીજ પ્રાથમિક સારવાર આપવામાં આવે છે. સામાન્ય રીતે લોકો એવું સમજતા હોય છે કે, બાળકને ઉંધુ લટકાવીને ગળામાં અટકેલી વસ્તુ બહાર કાઢી શકાય છે. પરંતુ આનાથી કયારેય ફાયદો થતો નથી પરંતુ બાળક પ્રેક્ટીસનાં અભાવે નીચે પટકાવાની શક્યતા રહે છે.


પ્રશ્ન-૩ એક વર્ષથી નીચેના બાળકને ચોકિંગ વખતે શું પ્રાથમિક સારવાર આપી શકાય ?

એક વર્ષથી નાની ઉંમરના બાળકોને પ્રાથમિક સારવાર આપતી વખતે તેને ઉંધુ લટકાવી પાછળનાં ભાગે હળવેથી

પાંચ થઘા લગાવવાથી ગળામાં અટકેલી વસ્તુ બહાર કાઢી
શકાય છે.



૫. હાર્ટ એટેક



- 👉 વ્યક્તિને ગભરામણ થાય, છાતીમાં દબાણ જેવો દુઃખાવો થાય અને તે દુઃખાવો ધીમે-ધીમે હાથ, ગળું, જડબું, પેટ કે પીઠ પાછળ આગળ વધે.
- 👉 આ દુઃખાવો મુખ્યત્વે છુદ્યનાં સ્નાયુઓમાં પુરાણાને લીધે હોય છે. આવો દુઃખાવો સામાન્ય આરામ લેવાથી દુર થતો નથી. ૧૦૮ ને ઝડપથી ફોન કરો અથવા બીજાને ફોન કરવા કહો.
હુદ્યનાં હુમલાનાં કિસ્સામાં ઝડપથી તબીબી સારવાર મળવી ખુબજ આવશ્યક છે કારણકે આ એક ખુબજ ગંભીર અને જુવલેણ સાબીત થઈ શકે છે.

૧. વ્યક્તિને આરામદાયક રિથ્યુમાં બેસાડો.
૨. ઈમરજન્સી એમ્પ્લ્યુલન્સ આવતા પહેતા તેને સતત સાંત્વના આપતા રહો.

પ્રશ્ન-૧ હૃદયનો હુમલો શું છે ?

જ્યારે હૃદયનાં સ્નાયુઓને મળતો રક્તનો જથ્થો ઓચીંતો બંધ પડી જાય ત્યારે હૃદયનો હુમલો થતો હોય છે. આથી હૃદય બરોબર કામ કરી શકતું નથી. હૃદય રોગની તીવ્રતા એ હૃદયનાં કયા સ્નાયુને કેટલી અસર થઈ છે તેના પર રહેલી છે.

પ્રશ્ન-૨ હાર્ટ એટેક અને કાર્ડીયાક અરિઝ માં શું તફાવત હોય છે ?

કાર્ડીયાક એરેસ્ટ એટલે હૃદયનું સંપૂર્ણ કામ કરતું બંધ થવું, જેનાથી વ્યક્તિ પડી જાય, બેભાન થઈ જાય અને તેના શાસોચ્છવાસની કીયા બંધ પડી જાય. આ હાર્ટ એટેક ને લીધે પણ હોઈ શકે છે. આના માટે વ્યક્તિને સીપીઆર આપવો જોઈએ.

પ્રશ્ન-૩ હાર્ટ એટેકનાં નીશાની અને લક્ષણો શું હોય શકે ?

ખુબજ પરસેવો વળવો, ગાભરામણ થવી, છાતીમાં દણ જેવો દુઃખાવો થાય અને તે દુખાવો ધીમે ધીમે હાથ, ગળું, જડબુ, પેટ કે પીઠ પાછળ આગળ વધે. ઝડપી અને ટુંકા શાસોચ્છવાસ.

પ્રશ્ન-૪ જે વ્યક્તિ પાસે હાર્ટ એટેકની દવા હોય તો શું કરવું જોઈએ ?

જો તેની પાસે દવા કે સ્પે હોય તો તેને જાતે જ લેવા દો. આપ તેને તેમ કરવામાં મદદ કરી શકો છો.

પ્રશ્ન-૫ શું આપણે તેને એસ્પીરીન આપી શકીએ ?

વ્યક્તિને મોં વડે ધીમે-ધીમે ચાવવા માટે એસ્પીરીન આપી શકાય, કે જેનાથી લોહી પાતળુ થવામાં મદદ થાય છે. પરંતુ વ્યક્તિને એક સાથે ૩૦૦ મીગ્રા થી વધારે આપી શકાય નહીં.


પ્રશ્ન-૬ જે વ્યક્તિ બેભાન હોય અને શાસોચ્છવાસ ન લેતો હોય તો આપણે શું કરવું જોઈએ ?

વ્યક્તિને ત્વરીત રીતે સીપીઆર આપો.

પ્રશ્ન-૭ એન્જાઈના શું છે ?

એન્જાઈના એટલે હૃદયમાં દબાણ લાગાવું. જ્યારે હૃદયની ધમની સાંકળી થઈ જાય અને હૃદયને અપુરતુ લોહી મળે. આ થવાનું મુખ્ય કારણ સામાન્ય રીતે વધુ પડતી કસરત અથવા આઘાત હોઈ શકે છે. જેના નીશાની અને લક્ષણો મુખ્યત્વે છાતીમાં દુઃખાવો, ટુંકા શ્વાસ પરંતુ હાર્ટ એટેક જેવાજ નિશાની અને લક્ષણો, અને સામાન્ય આરામથી કે ડોક્ટરની ભલામણથી આપાયેલી દવા દ્વારા વ્યક્તિ રીકવર થઈ શકે છે. એન્જાઈના દરમિયાન જો બે વખત દવા આપવાથી વ્યક્તિ રિકવર ના થાય તો હાર્ટ એટેકની શક્યતા જોઈ તાત્કાલીક ૧૦૮ ને ફોન કરવો અથવા બીજા કોઈને આમ કરવા કહેવું.

૬. સ્ટ્રોક



- 👉 F.A.S.T. નો ઉપયોગ કરો.
- 👉 Face (ચહેરો) ચહેરાની કોઈ એક બાજુ પર :
નબળાઈ દેખાવી?
- 👉 Arms (હાથ) શું તે બજે હાથ એક સાથે :
ઉંચકી શકે છે?
- 👉 Speech (અવાજ) શું તે શબ્દો કપાયા વગાર
બોલી શકે છે.
- 👉 Time (સમય) કોઈ પણ પ્રકારના વિલંબ વગાર
૧૦૮ ને ફોન કરો.

સ્ટ્રોક એ મગજમાં લોહીનાં પરિવહનનાં અટકવાથી થાય
છે. જ્યારે મગજનો કોઈ ભાગ દ્રોગ પામે છે ત્યારે

વ्यक्तिनां દેખાવ, શરીરનાં સામાન્ય કાર્યો, અવાજ અને દ્રષ્ટિને ગંભીર અસર પહોંચે છે.

૧. તાત્કાલીક ૧૦૮ ને ફોન કરો અથવા અન્યને આમ કરવા કહો.

મગાજનાં સ્ટ્રોક વખતે ઝડપથી તબીબી સારવાર એ વ્યક્તિનાં જીવન બચાવવા તેમજ ઈજામાં ઘટાડો કરવામાં મદદરૂપ બની રહે છે.

૨. એમ્બ્યુલન્સ આવતા સુધીમાં વ્યક્તિને સાંત્વના આપો.

પ્રશ્ન-૧ જો વ્યક્તિ ગભરાયેલો અને બેચેન હોય તો ?

વ્યક્તિને બેસાડીને આરામ અને સાંત્વના આપો.

પ્રશ્ન-૨ જો આપણને તે શું કહેવા માગો છે તે ન સમજાય તો ?

મગાજનાં સ્ટ્રોક બાબતમાં તુટક-તુટક અવાજ એ સામાન્ય લક્ષણ છે. વ્યક્તિને એમ્બ્યુલન્સ આવતા સુધી સાંત્વના આપવાનું ચાલુ રાખો.

**પ્રશ્ન-૩ મગજનાં સ્ટ્રોક વખતે સામાન્યતા ચહેરાની
નબળાઈ, હાથમાં લકવો, તુટક-તુટક અવાજ શા માટે
જેવા મળે છે ?**

મગજનાં સ્ટ્રોકમાં મગજનાં કોષોને રક્તપ્રવાહ મારફતે
ઓક્સિજન ન મળવાને લીધે તે મારવા લાગે છે જેથી
માનવ શરીરની સામાન્ય કીયાઓને અસર પહોંચે છે.
આથી માનવ શરીરનાં એક બાજુનાં અંગ અથવા કમરથી
નીચેના ભાગના અડધા અંગના કાર્યોને અસર પહોંચે છે.

**પ્રશ્ન-૪ આ સિવાય મગજનાં સ્ટ્રોકનાં જીજ શું લક્ષણો
હોઈ શકે છે. ?**

હાથ-પગ માં ખાલી ચડવી
આંખોમાં ધુંધળાપણું
અચાનક તીવ્ર માથાનો દુઃખાવો
શરીરનું સમતુલન ન રહેવું.
આગસ અને માથાનું ખાલીપણું

પોતાને રજુ કરવામાં તેમજ બીજાને સમજવામાં પડતી મુશ્કેલી

પ્રશ્ન-૫ આ સિવાય મગજનાં સ્ટ્રોકનાં બીજ શું લક્ષણો હોઈ શકે છે. ?

હંમેશા મગજનો ડાબો ભાગ જમણા તેમજ જમણો ભાગ ડાબા શરીરને નિયંત્રણ કરે છે. જો સ્ટ્રોકને લીધે મગજનાં જે બાજુનાં ભાગમાં ઈજા થઈ હોય તેની વિરુદ્ધ ભાગનાં શરીરનાં સામાન્ય કાર્યોને અસર પહોંચે છે.

૭. રક્તસ્ત્રાવ

- 👉 જો કાંઈ મળે તેનો યોગ્ય ઉપયોગ કરી ધાવ પર દબાણ આપી લોહીના પ્રવાહને ઓછો અથવા બંધ કરવા પ્રયત્ન કરો. આમ કરવાથી આપ લોહીને વહી જતું અટકાવવા પણ તરીકે કાર્ય કરો છો. આપના દ્વારા અપાયેલું દબાણ લોહી ને ગંઠાઈ જવામાં મદદરૂપ થઈ બંધ કરવામાં મદદરૂપ થાય છે.
- 👉 ઝડપથી ૧૦૮ ને ફોન કરવા અથવા અન્યને આમ કરવા કહો.
- 👉 તબીબી મદદ ન મળી રહે ત્યાં સુધી ધાવ પર દબાણ ચાલુ રાખો

પ્રશ્ન-૧ ધાવ પર દબાણ આપવા માટે શાનો ઉપયોગ કરી શકાય ?



આપની પાસે જે કંઈ વસ્તુ
હાય તેનો ઉપયોગ કરી
શકાય પ્રાથમિક સારવાર
ની પેટીમાંનું ડ્રેસીંગ જ
વાપરવું જરૂરી નથી

આપનો હાથ, ઘાયલ વ્યક્તિનો હાથ, ટી-શાર્ટ, નેઝીન,
રૂમાલ કે આવું કંઈ કે જેનાથી ઘાવ પરથી લોહીનો પ્રવાહ
ઓછો થાય કે બંધ થાય.

પ્રશ્ન-૨ જેના વડે ઘાવ પર દબાણ અપાયુ હોય તેમાં લોહી શોખાય તો શું કરવું જોઈએ ?

તેને ત્યાંથી દુર ના કરો પરંતુ તેના પર બીજુ કોઈ ચીજ
મુકી દબાણને જાળવી રાખવા પ્રયત્ન કરો. તુરંત જ ૧૦૮
ને ફોન કરો અથવા અન્યને ફોન કરવા કહો.

પ્રશ્ન-૩ ઘાયલ વ્યક્તિ શુષ્ક દેખાય, ઠંડી અને નબળાઈ મહેસુસ કરે છે. આનો અર્થ શું કરી શકાય ?

એટલે કે, વ્યક્તિનાં શારીરમાં યોગ્ય માન્યામાં લોહીનું
પરીબ્રમણ થતું નથી. આનાથી ગંભીર પરિસ્થિતી જેવી કે

ઓક્સિજન ની ઉણપ, છુદય નો હુમલો અથવા બીજા કોઈ અગત્યનાં અવયવોમાં નુકસાન તેમજ વ્યક્તિનું જીવન જોખમમાં આવી શકે છે. આવી સ્થિતીને શરીરનો પ્રતિભાવ અથવા આધાત કહે છે.

આવા આધાતનાં નિશાની અને લક્ષણો જણાય ત્યારે ઝડપ થી લોહી બંધ કરવાનો પ્રયત્ન કરો. વ્યક્તિનાં મગાજ અને છુદયને લોહીનો પુરતો જથ્થો મળી રહે તે હેતુથી વ્યક્તિ ને સુવડાવી તેના પગ ઉંચા કરી દો. જો બાકી હોય તો ૧૦૮ ને ફોન કરો. વ્યક્તિનું શરીર હુફાળુ રાખવા તેને ધાબળો વિંટાળી દો.

પ્રશ્ન-૩ શું ધાયલ વ્યક્તિને મદદ કરવા જતા આપણને રક્ત દ્વારા ચેપ લાગવાની શક્યતા છે ?

જો આપને ચેપ લાગવાની શક્યતા જણાતી હોય તો રક્ષણ માટે પ્લાસ્ટીકની કોથળી, ગલોવર્સ (મોજાં) અથવા ધાયલ વ્યક્તિનાંજ હાથનો દબાણ આપવા ઉપયોગ કરો.



પ્રશ્ન-૫ શું ધાવને ધોવો કે સાફ કરવો જોઈએ ?

સામાન્ય ધાવ કે ઊરડા વખતે ધાવને સાફ કરી કચરો બહાર કાઢી શકાય. તીવ્ર રક્તસ્ત્રાવ વખતે આમ કરવું નહીં. તીવ્ર રક્તસ્ત્રાવ વખતે આમ કરવાથી ગંઠાયેલું લોહી પણ ધોવાઈ જવાથી વધુ રક્તસ્ત્રાવ થવાની શક્યતા ખુબજ રહેલી છે.

પ્રશ્ન-૬ જે ધાવમાં કંઈ તીક્ષણ વસ્તુ કે કંઈ ફસાયેલું હોય તો શું કરવું જોઈએ ?

આ ફસાયેલી વસ્તુને બહાર કાટવાનો પ્રયત્ન ન કરવો જોઈએ કારણ કે તે ધાવ પર ખંગાનું કામ



કરે છે. ફસાયેલી વસ્તુની બહાર સામાન્ય દભાણ મળે એ રીતે પાટો કે કંઈ વિંટાળવું. ફસાયેલી વસ્તુને બહાર કાટવાથી ધાવ ખુલ્લો થઈને રક્તસ્ત્રાવ વધુ થાય છે.

પ્રશ્ન-૭ નસકોરી કુટે ત્યારે શું કરી શકાય ?

વ્યક્તિનાં નાકનો પોચો હિસ્સો દબાવી તેને આગાળ તરફ ઝડપીને બેસવા તેમજ મો વાટે શાસ લેવા કહો. નાક દબાવવાથી લોહી ગંઠાવાની કિંયામાં મદદરૂપ થવાય છે.

વ્યક્તિને પાછળ તરફ નમીને બેસાડવો હિતાવહ નથી. આમ કરવાથી વ્યક્તિના શાસમાર્ગમાં તેમજ પેટમાં લોહી જઈ શકે છે જેનાથી શાસમાર્ગમાં અડયણ તેમજ ઉલ્ટી થઈ શકે છે.

આમ કરવાથી પણ લોહી બંધ ન થાય તો ત્વરીત રીતે ૧૦૮ ને ફોન કરવો.

૪. પાટા અને પહૂણી બાંધવાની રીતો

ડ્રેસિંગ

પ્રાથમિક સારવારમાં ડ્રેસિંગ અથવા પહૂણીનો ઉપયોગ જુદા-જુદા હેતુ માટે થતો હોય છે. જેમાં ઘાવને ટાંકવો, તેનું ચેપ સામે રક્ષણ કરવું, ઘાવમાંથી વધારનું પ્રવાહી ચુસવું રક્તસ્તાવ બંધ કરવો વગેરે મુખ્ય બાબત છે.

અસારકારક પહૂણી એટલે સંપુર્ણ જંતુરહિત કરેલી પહૂણી કે જેની પરસેવો અને પ્રવાહી ચુસવાની ક્ષમતા વધારે રહેલી હોય છે.

ડ્રેસિંગના પ્રકાર

૧. એડહેસિવ ડ્રેસિંગ (બેન્ડ એઈડ)

આ જંતુરહિત પહૂણી જુદા-જુદા પ્રકારની હોય છે જેમાં એડહેસિવની જગ્યાએ સેલ્ફુલોગનાં સ્તર વાળી પ્રવાહીશોષક નો ગુણાધર્મ ધરાવતી ઝાળી લગાવેલી હોય છે. આ પહૂણી લગાવતા પહેલા આસપાસની ચામડી બેજરહિત અને છેડાઓ બરોબર દબાયેલા હોવા ખુબ જરૂરી છે.

આ પ્રકારની પણીઓ પ્લાસ્ટિક કવરમાં વિટળાયેલી જોવા મળે છે.

૨. નોન એડહેસિવ ડ્રેસિંગ

આ એક જંતુરહિત તૈયાર પણી કે જેમાં પણીની જાળી વચ્ચે રૂનું બનાવેલું પેડ રાખવામાં આવે છે. જેના બજ્જે છેડા ટી આકારના પટા સાથે જોડાયેલા હોય છે.

ગોગ પીસ

સામાન્ય રીતે આ પણી ખુબજ નરમ અને શોષ ગુણ ને લીધે મોટા તેમજ તીવ્ર રક્તસત્રાવ ધરાવતા ઘાવ પર લગાવવામાં આવે છે. જેમાં પાટા વચ્ચે રૂને વિંટાળીને બનાવવામાં આવે છે.

કામચલાઉ પણી

આ પણી કોઈપણ પ્રકારના નરમ અને સ્વચ્છ કપડા જોવા કે રૂમાલ, નેપકિન, દુપણી કે સ્ટાફ નો ઉપયોગ કરી બનાવી શકાય છે.

પછીનો ઉપયોગ

પટીનો ઉપયોગ હંમેશા ધાવને ટાંકવા માટે થતો હોય છે. શક્ય હોય તો આમ કરતી વખતે ગ્લોવઝ પહેરવા ખુબજ જરૂરી છે. પછી લગાવતી વખતે નીચે મુજબ કાળજી રાખવી જરૂરી છે.

- 👉 તમારા હાથ સાબુ અને પાણીથી બરાબર ધુઅં.
- 👉 તમારા હાથ કે આંગળા વડે ધાવને તેમજ પછીના કોઈપણ ભાગ કે જે ધાવને સ્પર્શ કરવાનો હોય તેને અડકવાનું ટાળો
- 👉 પછી લગાવતી વખતે ધાવ તરફ મૌં રાખી વાત કરવી કે ઉધરસ ખાવી નહીં.

પાટાઓ

પાટાઓ હંમેશા ફ્લેનલ કેલીકો અથવા સ્થિતીસ્થાપક કપડામાંથી બનાવવામાં આવે છે. આ પ્રકારનાં કોઈપણ કપડામાંથી બનાવેલા મટિરીયલનાં સ્વરષ્ણ કપડાનો ઉપયોગ કામચલાઉ પાટા તરીકે કરી શકાય છે. પાટાનો મુખ્યત્વે ઉપયોગ નીચે મુજબ કરવામાં આવે છે.

- 👉 રક્તસ્ત્રાવ રોકવા ધાવ પર લગાવેલી પછી પર સીધુ દબાણ આપવા.
- 👉 પછી, સ્લીંગ કે સ્પલીંટને પોતાની જગ્યાએ જકડી રાખવા.
- 👉 સોજો આવતો આછો કરવા કે રોકવા.
- 👉 હાથ પગ કે સાંધાનાં કોઈ ભાગને આધાર આપવા.
- 👉 હલનચલન ઓછું કરવા કે અટકાવવા.
- 👉 ધાયલ વ્યક્તિને ઉંચકવા કે બાંધવા માટે.
- 👉 જ્યારે બીજા પ્રકારનો સરસામાન ઉપલબ્ધ હોય ત્યારે પાટાનો ઉપયોગ કર્યારેય ગાંદી બનાવવા કરવો નહીં.

પાટાનો ઉપયોગ પછી કે સ્પલીંટ ને જકડી રાખવા તેમજ રક્તસ્ત્રાવ બંધ કરવા થતો હોઈ, પાટાને શરીરમાં રૂધિરાભિષણ સંદર્ભ બંધ થઈ જાય કે વ્યક્તિ ને અન્ય ઈજા કે દુખાવો થાય એટલો ચુસ્ત રીતે બાંધવો નહીં. આંગળીઓ કે નખ પર આછો વાદળી રંગ ઉભરી આવવો એ પાટો ખુબજ ચુસ્તરીતે બંધાયેલો અને રૂધિરાભિષણ સંદર્ભ બંધ થયાનો ગંભીર સંકેત હોય છે. સંવેદના ન

અનુભવવી એ પણ ગંભીર બાબત છે જેના ઉપાય તરીકે પાટાને ટીલો કરવો ખુબજ જરૂરી છે.



પાટાનાં પ્રકારો

પ્રાથમિક સારવારમાં મુખ્યત્વે બે પ્રકારનાં પાટાઓનો ઉપયોગ કરવામાં આવે છે.

- a. ટ્રિકોણાકાર પાટા
- b. વિંટા આકારનાં પાટાઓ

ટ્રિકોણાકાર પાટાઓ

મુખ્યત્વે ૧૦૦ સેમી કેલીકો પ્રકારનાં કાપડનાં એક ખુણેથી બીજા ખુણા સુધી ચીરીને તેમાંથી બે પાટા બનાવવામાં આવે છે. આ પાટાને ત્રણ બાજુ હોય છે. સોથી લાંબી બાજુ એ પાયો તેમજ બીજી બજે પરસ્પર બે બાજુઓ. પાટાને કુલ ત્રણ ખુણા હોય છે. પાટાની વિરુદ્ધ બાજુ એટલે કે ઉપરનાં ખુણાને પોઈન્ટ તેમજ બીજા બજે ખુણાને છેડ કહે છે.



ત્રિકોણાકાર પાટાનો ઉપયોગ

- 👉 સમગ્ર રીતે ખુલ્લો કરીને
- 👉 પહોળા પાટા તરીકે પોઇન્ટને પાચા
- સુધી લઈ જઈ ફરીથી આજ રીતે એક
 વખત વાળીને
- 👉 સાંકડા પાટા તરીકે-પહોળા પાટાને ફરી એક વખત
 વાળીને
- 👉 બદ્લે છેડાને ભેગા કરીને નાના ત્રિકોણાકાર પાટા તરીકે

ત્રિકોણાકાર પાટા બાંધવાની રીતો

રીફ નોટ

ત્રિકોણાકાર પાટો બાંધતી વખતે હંમેશા રીફ નોટના ઉપયોગ કરવો જેથી પાટો છુટે નહીં અને ખોલવા માટે સરળતા રહે. જે તે ઘાવની ઉપર ગાંઠ લગાવવાનું ટાળવું જેથી વ્યક્તિને અસરળતા ના રહે.

રીફ નોટ બાંધવાની રીતો

૧. ડાબા હાથના છેડાને જમણા હાથના છેડાની ઉપરથી અંદરતરફ સરકાવો.
૨. બજે છેડાને ઉપરથી અંદરતરફ ખેંચો.
૩. ફરીથી ડાબા હાથના છેડાને જમણા હાથના છેડાની ઉપરથી અંદર તરફ સરકાવો.
૪. બજે છેડા એક બીજાથી વિરુદ્ધ દિશામાંથી ખેંચો.

૧. ત્રિકોણાકાર પાટો બાંધતી વખતે હંમેશા રીફ નોટનો જ ઉપયોગ કરવો.
૨. સામાન્યત વપરાતી ગેની નોટનો ઉપયોગ ના કરવો.
૩. ગાંઠને લીધે વ્યક્તિને પીડા કે દુખાવો ન થવો જોઈએ.

૪. ટ્રિકોણાકાર પાટો જ્યારે ઉપયોગમાં ન હોય ત્યારે સાંકડો કરી નાખવો. બજે છેડાને વર્ચ્યેના ભાગમાં વાળી દેવા.
સામાન્યતઃ એ ૧૬ x ૮ સે.મી. પેકેટ જેવું દેખાય છે.

જોળીઓ

જોળીઓનો ઉપયોગ

- 👉 ઈજાગ્રસ્ત ભાગને આધાર આપવો.
- 👉 છાતી, ખભા અને ગળાની ઈજાઓમાં હલન-ચલન અટકાવવું.

જુદા-જુદા પ્રકારની જોળીઓ

૧. હાથની જોળી



૨. કોલર અને કફની જોળી




૩. ટ્રિકોણાકાર જોળી

૪. જુદી-જુદી વસ્તુઓનાં ઉપયોગ વડે કામચલાઉ જોળી
૫. પાંસળીઓનો અસ્તિભંગ, હાથ કાંદુ કે પંજમાં ઈજાઓ કે સ્પલીન્ટના ઉપયોગ પછી જોળી બાંધવામાં આવે છે.

ટ્રિકોણાકાર પાઠા વડે બાંધવાની રીતો

૧. માથાનો પાઠો



૨. કપાળ, આંખ, ગાલ કે

ચહેરાનાં કોઈપણ ભાવનો
પાઠો

૩. છાતીનો આગાળ કે પાછળનાં

ભાગનો પાઠો.

૧. ખભાનો પાટો
૨. કોણીનો પાટો
૩. હાથનો પાટો
૪. જંઘનો પાટો
૫. દુંગણાનો પાટો
૬. પગનાં પંજાનો પાટો
૭. હથેળીનો પાટો

વિંટા આકારના પાટા (રોલર બેન્ડેજ)

રોલર બેન્ડેજ સામાન્યત દવાખાના અને પ્રાથમિક સારવાર કેન્દ્રોમાં વપરાય છે. તે સામાન્ય રીતે કોટનનાં ઝાંખી જાળીવાળા કાપડમાંથી બનાવવામાં આવે છે.

રોલર બેન્ડેજની પહોળાઈઓ

રોલર બેન્ડેજ પણ પટીને જે તે જગ્યા પર જકડી રાખવા અને બાહ્ય દબાણ આપવા વપરાય છે.



શરીરનો ભાગ	પાટાની પહોળાઈ
આંગણી	૨.૫ સેમી (૧ ઈંચ)
હાથ-કોણીથી નીચે	૫ સેમી (૨ ઈંચ)
હાથ-કોણીથી ઉપર	૫ અથવા ૬ સેમી (૨ અથવા ૨.૫ ઈંચ)
પાં દુંટણાથી નીચે	૭.૫ અથવા ૮ સેમી (૨ અથવા ૩.૫ ઈંચ)
પાં દુંટણાથી ઉપર	૧૦ અથવા ૧૫ સેમી (૪ થી ૬ ઈંચ)

રોલર બેન્ડેજ (વીંટા આકારનો પાટો) બાંધવાના નિયમો

રોલર બેન્ડેજ હંમેશાં શરીરનાં બાહ્ય ભાગથી લઈને અંદરના ભાગ તરફ બંધાય છે. રોલર બેન્ડેજ ખુબ સખત કે ટીલી નહીં. બેન્ડેજનો બહારનો હિસ્સો પટી પર આવે તે રીતે પાટો પકડવો. આ પાટો વિંટાળતી વખતે આગામનાં વિંટા પર ૨/૩ ભાગ ટંકાય તે રીતે આગામ વધવું.

રોલર બેન્ડેજ બાંધવાની મુખ્યત્વે ગ્રણ રીતો છે.


૧. સીમ્પલ સ્પાયરલ
૨. રીવર્સ સ્પાયરલ

૧. ફીગાર ઓફ એઇટ



६. अस्थीभंगा - फ्रेक्चर

👉 घायल व्यक्तिनां
 ईज पामेला
 भागाने तेना हाथ
 वडे टेको आपवा
 के ओशिङ्कु अथवा
 आवी कोई वस्तु
 वडे बिनाजृदी
 हलनयलन ओषुं
 करवा मददृप
 बनो।



- 👉 आ रीते टेको आपवाथी व्यक्तिनी ईजमां वधारो थतो अटके तेमज दुःखावो ओछो थाय छे.
- 👉 १०८ ने तुरंत ज फोन करो अथवा अन्यने आम करवा कहो.
- 👉 तबीबी मदद आवता सुधी घायल थयेला भागाने टेको आपवो खुबज आवश्यक छे.

પ્રશ્ન-૧ ફેકચરનાં સામાન્ય લક્ષણો શું હોઈ શકે છે ?

ઇજા પામેલા ભાગ પર દુઃખાવો, સોઝો, છુંદાયેલાનું નિશાન અથવા જે તે ભાગનાં આકારમાં ફેરફાર અથવા વિકૃતિ. ઘણી વખત આ સાથે ખુલ્લો ઘાવ તેમજ હાથ કે પગ છુટા પડેલા હોઈ શકે છે.

પ્રશ્ન-૨ ફેકચર થયેલા ભાગને કઈ રીતે ટેકો આપી શકાય ?

બિનજરુરી હલન ચલન ક્યારેય કરવું નહીં. શક્ય હોય તો પોચા કપડા કે ધાબળો જેવું કંઈ ફેકચર થાયેલા ભાગની



આસપાસ મુકો પરંતુ દબાણ આપવું નહીં. તબીબી મદદ આવતા સુધી આમ કરવાનું ચાલુ રાખો.

પ્રશ્ન-૩ જે વ્યક્તિ ઇજા પામેલા ભાગ ને ટેકો આપવા ના કહે તો શું કરવું જોઈએ ?

વ્યક્તિ ને પોતાના હાથેજ ટેકો કે ધાબળો વગેરે વીંટળવા દો.

**પ્રશ્ન-૪ જો હાડકુ સાંધામાંથી ખસી ગયું હો ય કે તુટી ગયું
હોય તેવા સંજોગોમાં તેને પાછું મુળ જગ્યાએ લગાવવા
પ્રયત્નો કરવા જોઈએકે નહીં ?**

ના, આવા સંજોગોમાં તબીબી સારવાર વખતે જ યોગ્ય
નિર્ણય લઈ શકાય. પ્રાથમિક સારવાર વખતે આવું કરવાથી
વધારે નુકસાન થઈ શકે છે.


**પ્રશ્ન-૫ ફક્ત ઘાવ અને બધુ સામાન્ય લાગતુ હોય તેવા
સંજોગોમાં શું કરી શકાય ?**

ઇજાનું કારણ જાણાવા નો પ્રયત્ન કરો કે જેનાથી હાડકુ
ભાંગવાની શક્યતા પ્રબળ જણાય. ખાસ કરીને આવા
સંજોગોમાં ફેક્ચર, મચકોડ કે સ્નાયુઓનું ખેંચાણમાં તફાવત
પાડવો એ એક્સ-રે વગાર અશક્ય છે. છેલ્લુ નિદાન ફક્ત
તબીબી સારવાર વખતે જ થઈ શકે છે.

**પ્રશ્ન-૮ વ્યક્તિ જાતે જ પોતાના પગ પર ઉભો રહી શકે કે
હલન ચલન કરી શકે તેવા સંજોગોમાં આપણે તેને ફેકચર
નથી થયું તેમ સમજવું જોઈએ ?**

હાડકુ ભાંગી જવું એ ફૂક્ત એક્સ-રે લારા જ ખબર પડે છે.
વ્યક્તિ હલન-ચલન કરતો હોય ત્યારે પણ તેના હાડકામાં
ફેકચર હોઈ શકે છે. જો વ્યક્તિને સખત દુઃખાવો થતો હોય
તો તુરંત જ તબીબી સારવાર માટે રીફર કરો.

૧૦. માથાની ઈજા



- 👉 તેમને આરામ કરવા કહ્યો અને ઈજા થયેલા ભાગ પર ઠંડી વસ્તુ, બરફની થેલી, ઠંડુ નેફીન વગોરે મુકો. માથામાં ઈજા થયેલા ભાગ પર કંઈક ઠંડુ મુકવાથી દુખાવો અને સોજો ઓછો થાય છે. ખોપરીમાં ઈજા થવાથી વ્યક્તિનું મગાજ થોડું હલે છે અને વ્યક્તિ નબળાઈ અનુભવે છે.
- 👉 જો વ્યક્તિ ને આળસ ચડે અને ઉલ્ટી થાય તો તુર્ચંત જ ૧૦૮ ને ફોન કરો. અથવા બીજાને ફોન કરવા કહ્યો.

પ્રશ્ન-૧ માથાની ઈજામાં બાધ્ય દુઃખાવો કે સોજો ઓછો કરવા શું કરી શકાય ?

બરફ કે ઢંડા શાકભાજુ ને ટુવાલ અથવા ઝમાલ વગેરે માં વિંટોળી ઈજા પર લગાવી શકાય. આ જગ્યા એ ભીનું કપડું કે ટુવાલ પણ વાપરી શકાય. ક્યારેય ચામડી સાથે સીધો બરફ લગાવવો નહીં.

પ્રશ્ન-૨ માથા ના દુઃખાવા માટે પેઈન કીલર દવાઓ આપી શકાય ?

ના, પેઈન કીલર દવાઓથી મગાજની તકલીફમાં વધારો થઈ શકે છે.

પ્રશ્ન-૩ માથાની ઈજાનાં સંજોગોમાં એમ્બ્યુલન્સ કચારે બોલાવવી જોઈએ ?

જો વ્યક્તિને ઉલ્ટી થાય કે અર્ધબેભાનવરસ્થા જોવા મળે ત્યારે એમ્બ્યુલન્સ બોલાવવી જોઈએ. જ્યારે આપણે વ્યક્તિની ઈજાની ગંભીરતા બાબતમાં ઝ્યાલ ન હોય ત્યારે પણ એમ્બ્યુલન્સ બોલાવવી જોઈએ.

પ્રશ્ન-૪ કનકશાન શું છે ?

માથાનાં બાહ્ય ભાગમાં ઈજા થવાથી મગાજ અંદરના ભાગમાં થોડું હલે છે જેને કનકશાન કહે છે. જેનાથી વ્યક્તિ થોડો સમય બેભાન બની જાય છે. મોટાભાગનાં કેસોમાં વ્યક્તિ રીકવર થઈ જાય છે પરંતુ ક્યારેક આ એક ગંભીર બાબત બની રહે છે. કોઈને આ રીતે કનકશાન જોવા મળે ત્યારે તુર્ટં જ ૧૦૮ ને ફોન કરો અથવા વ્યક્તિને તબીબી સારવાર માટે રીફર કરો.

પ્રશ્ન-૫ કોઈ વ્યક્તિને થયેલી માથાની ઈજામાં કનકશાન નાં લક્ષણોને જોઈ શકાય છે ?

હા, માથાની ઈજા ને લીધે થયેલા કનકશાનનાં લક્ષણોને જોઈ શકાય છે. આવા લક્ષણો વખતે તાલ્કાલીક ૧૦૮ ને ફોન કરવો જોઈએ.

પ્રશ્ન-૪ કનકશાનનાં લક્ષણો શું હોઈ શકે છે ?

કનકશાનનાં લક્ષણો:-

- 👉 આળસ
- 👉 માથાનો દુખાવો અને બેચેની
- 👉 બિમાર દેખાવું
- 👉 આંખે અંધાપો
- 👉 શુષ્ણી ચડવી
- 👉 યાદ શકતકિમાં ઘટાલો

૧૧. દાંડવું



- 👉 ઓછામાં ઓછા દસ મિનિટ સુધી દાંડેલા ભાગને વહેતા પાણીમાં ઠંડો રાખો.
- 👉 આમ કરવાથી દાંડવાની ઈજા, સોજો તેમજ દુઃખાવો ઓછો થશે. ઈજા પામેલા ભાગને ઝડપથી ઠંડો કરવાથી જે તે ભાગને થતું લાંબા ગાળાનું નુકશાન ઓછું કરી શકાય છે.
- 👉 દાંડી ગયેલો ભાગ ઠંડો થયા પછી તેને પ્લાસ્ટિક ફીલ્મ કે બેગ વડે ટાંકી દો અથવા વિંટાળી દો.
- 👉 દાંડી ગયેલો ભાગ સ્વચ્છ રહેતો હોવાથી ચેપ લાગવાની શક્યતા નહિવત બની જાય છે. આમ કરવાથી ચામડીના સ્તર પર હવા નથી લાગતી તેમજ તે ચામડી સાથે ચોટી જતું ન હોવાથી એક આદર્શ આવરण રચાય છે.

- 👉 જરૂર જણાય તો ૧૦૮ ને ફોન કરો અથવા બીજાને ફોન કરવા કહો
- 👉 દાખલાના કિસ્સામાં હંમેશા તત્કાલ તબીબી સારવારની આવશ્યકતા હોય છે. જો બાળક દાખ્યું હોય તેવા કિસ્સામાં વિના વિલંબે તુર્ટ જ ૧૦૮ ને ફોન કરો અથવા અન્યને આમ કરવા કહો.

પ્રશ્ન-૧ દાખલાની પ્રાથમિક સારવારમાં માખણ કે કીમ નો ઉપયોગ કરી શકાય ? સાંભળ્યું છે કે તેનાથી રાહત થાય છે.

ના, માખણ થી કચારેય શરીરનો ભાગ ઠંડો પડતો નથી. તેલ હંમેશા ગરમી વધારનાર બની રહે છે. દાખલાના કિસ્સામાં હંમેશા આપણી જરૂરીયાત (ઠંડુ પાડવુ) થી ઉલ્ટુ કામ કરે છે. જો દાખેલા ભાગ પર કંઈ પણ લગાવ્યું હશે તો પાછળથી તેને સાફ કરવું પડતુ હોવાથી તે ખુબજ પીડાદાયક અને નુકશાન કરનાર બની રહે છે.

પ્રશ્ન-૨ શું દાઝેલા ભાગ પર બરફ લગાવી શકાય ?

ના, હંમેશા પાણીનો જ ઉપયોગ કરવો. બરફ થી ચામડીને નુકશાન થઈ શકે છે.

પ્રશ્ન-૩ દાઝવાનાં કિસ્સામાં વ્યક્તિને ક્યારે હોસ્પિટલ લઈ જવો જોઈએ ?

જો બાળક દાઝ્યુ હોય તો, વિના વિલંબે ૧૦૮ ને ફોન કરો અને વ્યક્તિને તબીબી સારવાર માટે રિફર કરો. પુખ્ત વ્યક્તિનાં કિસ્સામાં જો ચહેરો કે ગૃહાંગ દાઝ્યા હોય અથવા આપને વ્યક્તિની સ્થિતિ ગંભીર જણાય ત્યારે તુર્ચંત જ ૧૦૮ ને ફોન કરો અથવા અન્યને ફોન કરવા કહો.

પ્રશ્ન-૪ દાઝેલા ભાગ પર પ્લાસ્ટર કે પાટો લગાવી શકાય ?


ના, દાઝેલા ભાગ પર પાટો કે પ્લાસ્ટર ક્યારેય લગાવવા નહીં. તે ચામડી પર ચોટી જતા હોવાથી વધારે નુકશાન કરનારા બની રહે છે. પ્લાસ્ટીક બેગ કે ફીલ્મ થી હંમેશા ચેપને રોકી શકાય છે.

પ્રશ્ન-૫ જો દાઢેલા ભાગ પર કપડા ચોટી ગયા હોય તો તેને ઉખાડવા જોઈએ ?

ના, દાઢેલા ભાગની આસપાસનાં કપડા કે ઘરેણા ઈત્યાદિ
કાઢી નાખવા જોઈએ પરંતુ દાઢેલા ભાગ પર ચોટેલા
કપડા ક્યારેય કાટવા ન જોઈએ કારણકે તેનાથી વધુ
નુકશાન થઈ શકે છે.



૧૨. અસ્થમા (દમ)



- 👉 વ્યક્તિને આરામદાયક સ્થિતીમાં બેસાડી તેમની પાસેની દવા લેવામાં મદદરૂપ થયું.
- 👉 અસ્થમાનાં હુમલા લખતે શ્વાસમાર્ગની નળીઓ સંકોચાવાથી વ્યક્તિને શ્વાસ લેવામાં ખુબજ મુશ્કેલી પડે છે. ઈનહેલરના ઉપયોગથી સ્નાયુઓ ટીલા થાય છે અને શ્વાસોછ્વાસની કીયામાં સરળતા રહે છે.
- 👉 વ્યક્તિ ને સાંત્વના આપો, અને તીવ્ર ગંભીર પરિસ્થિતિ જણાય તો તુર્ચંતજ ૧૦૮ ને ફોન કરો અથવા અન્યને આમ કરવા કહો.

 સામાન્ય હુમલાઓ થોડા સમય પછી શાંત થઈ જતા હોય છે પરંતુ જો ઈનહેલરની કોઈ જ અસર ના જણાય તો ટાઇલિક દવાખાને પહોંચાડો.

પ્રશ્ન-૧ અસ્થમાં શું છે ?

અસ્થમાં એ એક એવી તબીબી સ્થિતિ છે કે, જેમાં ફેફસામાં થી અંદર અને બહાર જતી શ્વાસનળીઓને અસર પહોંચે છે. જ્યારે કોઈને અસ્થમાનો હુમલો આવે છે ત્યારે, આ નળીઓ સંકોચાવાથી શ્વાસ ને અંદર અને બહાર આવવા અને જવામાં ખુબજ મુશ્કેલી પડે છે.

પ્રશ્ન-૨ અસ્થમાની નિશાની અને લક્ષણો શું હોઈ શકે છે ?

સામાન્ય રીતે જે તે વ્યક્તિ પોતેજ આ સ્થિતી ને સંભાળી લે છે અને અસ્થમાનાં હુમલા વિશે બીજાને જણાવી શકે છે. તેમને બોલવામાં, શ્વાસ લેવામાં તકલીફ સાથે ઉધરસ તેમજ સીટી જેવો અવાજ આવે છે. આવા સમયે વ્યક્તિને શ્વાસ લેવામાં મુશ્કેલી પડતી હોવાથી તે બેચેન અને વ્યાકુળ જણાય છે. ક્યારેક વ્યક્તિનાં શરીરમાં

ઓક્સિજનની ઉણાપ સર્જવાથી વ્યક્તિનાં હોઠ, કાનની બુટ,
અને નખનો રંગ વાડળી થયેલો જોવા મળે છે.

**પ્રશ્ન-૩ જો વ્યક્તિ શાસ લેવાનું બંધ કરી દે તો આપણે
શું કરવું જોઈએ ?**

સી.પી.આર. આપો

પ્રશ્ન-૪ જો વ્યક્તિ પાસે ઈનહેલર ના હોય તો ?

કોઈ પણ પ્રકારના વિલંબ વગાર ૧૦૮ ને ફોન કરો અને
વ્યક્તિને તબીબી સારવાર માટે રીફર કરો.

પ્રશ્ન-૫ આપણે ૧૦૮ ને કચારે ફોન કરવો જોઈએ ?


નીચેના નિશાની અને લક્ષણો જણાય ત્યારે ૧૦૮ ને ફોન
કરવો જોઈએ.

- 👉 જો તેને પહેલી વખત અસ્થમાનો હુમલો આવ્યો હોય
- 👉 વ્યક્તિનાં શાસોછ્યવાસ બંધ થઈ જાય
- 👉 બોલવામાં મુશ્કેલી જણાય
- 👉 બેચેની અનુભવાય

- 👉 ઈનહેલર કે દવાની કોઈ જ અસર ના જણાય
- 👉 વ્યક્તિ પાસે કોઈ દવા કે ઈનહેલર ના હોય



૧૩. ડાયાબિટીસ ઇમરજન્સી



૧. તેને કંઈ ગણ્ય અથવા નોન-ડાયેટ પીણું આપો.

ડાયાબેટીક કટોકટી વખતે વ્યક્તિનાં શરીરમાં સુગરનું પ્રમાણ ખુબજ ઘટી જવાથી વ્યક્તિનાં શરીરનાં શરીરને ધક્કો લાગે છે. કંઈક ગણ્યો પદાર્થ તેને આપવાથી તેના શરીરનું સુગર લેવલ જળવાય છે અને શરીર ફરી પાછું સામાન્ય કીચાઓ કરતું થઈ જાય છે.

તેને કોઈ ડાયેટ પીણું આપવું નહીં કારણકે તેમાં સુગરનું પ્રમાણ બિલકુલ હોતું નથી.

વ્યક્તિને સાંત્વના અને આરામ આપો. મોટા ભાગનાં વ્યક્તિ ઓ થોડા સમયમાં સામાન્ય થઈ જતા હોય છે પરંતુ

ગંભીર સ્થિતી જણાય તો તુર્ચંત જ ૧૦૮ ને ફોન કરો અથવા
અન્ય ને આમ કરવા કહો

પ્રશ્ન-૧ ડાયાબિટીસ શું છે ?

ડાયાબિટીસ એ એક એવી મેડિકલ કન્ડીશન છે કે જે
વ્યક્તિનાં શરીરમાં રહેલા સુગારનાં પ્રમાણને અસર કરે છે.
સામાન્ય રીતે માણસનાં શરીરમાં સુગારનું પ્રમાણ યોગ્ય
રીતે કુદરતી રીતે જે જળવાતું હોય છે. જ્યારે વ્યક્તિને
ડાયાબિટીસ હોય છે ત્યારે તેના શરીરમાં સુગારનું પ્રમાણ
યોગ્ય રીતે જળવાતું નથી તેથી તેને આ પ્રમાણ જળવવા
માટે ડાયેટ, દવાઓ કે ઈનસ્થ્યુલીનના ઈન્જેક્શન લેવા પડે
છે. ક્યારેક આવી વ્યક્તિઓમાં ડાયાબેટીક કટોકટી
નિર્માણ પામે છે જેમાં વ્યક્તિને પ્રાથમિક સારવાર આપવાની
જરૂર પડે છે.

પ્રશ્ન-૨ ડાયાબિટીસનાં નિશાની અને લક્ષણો શું હોય છે ?

નિશાની અને લક્ષણો ઘણા બધા હોઈ શકે છે પરંતુ મુખ્ય
રીતે નીચે મુજબ હોઈ શકે છે.

- ➡ ભુખ લાગવી
- ➡ આંચકી આવવી
- ➡ ચામડીમાં શુષ્કતા
- ➡ પરસેવો વળવો
- ➡ નબળાઈ અને શુષ્કતા
- ➡ બેચેની
- ➡ ચક્કર આવવા
- ➡ અચાનક બેભાન અવસ્થા

પ્રશ્ન-૩ ડાયાબેટીક ઈમરજન્સીમાં શું થાય છે ?

મુખ્યત્વે, વ્યક્તિનાં શારીરમાં સુગરનું પ્રમાણ ખુલ્લ જ ઘટી જાય છે. જેને હાઈપોગ્લાયસેમિયા કહે છે. સામાન્ય રીતે વ્યક્તિ જયારે જમવાનું ચુકી જાય અથવા ખુલ્લજ કસરત કરે ત્યારે આવું જોવા મળે છે. જો વ્યક્તિને યોગ્ય સારવાર આપવામાં ના આવે તો વ્યક્તિ કોમા અથવા મૃત્યુ પામી શકે છે.

પ્રશ્ન-૪ આપણે ૧૦૮ ને કયારે ફોન કરવો જોઈએ ?

જો વ્યક્તિની પરિસ્થિતીમાં સુધારો ન આવે અથવા વ્યક્તિ બેભાન થઈ જાય તેવા સંજોગોમાં તાત્કાલીક રીતે ૧૦૮ ને ફોન કરવો.

પ્રશ્ન-૫ વ્યક્તિને ડાયાબિટીસ હશે એ શી રીતે જણી શકાય ?

સામાન્ય રીતે વ્યક્તિ પોતે એ જણાવી શકે છે તેથી તે જે કંઈ કહે તે ધ્યાનથી સાંભળવું. તેના શરીર પર કંઈ વ્યક્તિ ડાયાબેટીક છે તેવું કાર્ડ, લોકેટ કે એવું કાંઈ પહેંચેલું હોય.

પ્રશ્ન-૬ ઘણા લોકોને લોહીમાં સુગરનું પ્રમાણ વધુ રહેતુ હોય છે આવા સમયે સુગરવાળો પદાર્થ આપવાથી તેને નુકશાન થઈ શકે ?

ઘણા લોકોને સુગરનું પ્રમાણ વધારે હોય છે, આવા સમયે સુગરવાળો પદાર્થ આપવાથી તેને કંઈ નુકશાન થતું નથી.

૧૪. તણાવ

- 👉 તમે વ્યક્તિને સાંભળો છો તેવા પ્રતિભાવ સાથે
વ્યક્તિને મદદ માટે પુછો. આમ તેનો આદર
કરવાથી તમે તેનો વિશ્વાસ જુતી શકશો.
- 👉 આસપાસ શું થઈ રહ્યુ છે અને તેની જરૂરીયાત શી
છે તે જાણવા પ્રયત્ન કરો.
- 👉 યાદ રાખાં આવા લોકો પોતાની જરૂરીયાત રજુ
કરી શકતા નથી. દા.ત. તે તમારી ભાષા સમજવા
માં અસમર્થ હોય.

**પ્રશ્ન-૧ આફતનાં સમયે આ રીતે બીજાને મદદ કરવાથી
શું આપણી માનસીક સ્થિતીને અસર પડતી હોય છે ?**

ના, સામાન્ય રીતે લોકો આવા કાર્યથી આનંદ અનુભવતા
હોય છે નહી કે અસરગ્રસ્ત. જો આપને બેચેની થાય તો
તમારી સ્થિતી વિશે બીજા સાથે વાત કરો કે જેમના પર
આપને વિશ્વાસ હોય. જો તમારા આરોગ્ય વિષે તકલીફ
જણાય તો તમારા ડોક્ટરનાં સંપર્ક કરો.

પ્રશ્ન-૨ જો પિડીતને તેમની જરૂરીયાતનો ખ્યાલ ન હોય અથવા રજુ ન કરી શકતા હોય તો ?

તેઓને સાંભળો, સાંભળો, સાંભળો અને તેઓના વતી બીજા કોઈનો સંપર્ક કરો. વ્યક્તિને શાંત રીતે આશ્ચાસન આપો કે તમે તેને મદદ કરી શકો છો.

પ્રશ્ન-૩ જો આપણાને તે વધુ પડતું નાટક કરે છે તેવું લાગે તો ?

દરેક વ્યક્તિ ની જરૂરીયાત, અનુભવો અને જરૂરત વ્યક્ત કરવાની પદ્ધતિ આપણાથી જુદા હોઈ શકે. હંમેશા તેને સંભાન આપી તે શું કહેવા માંગો છે તે સાંભળવા પ્રયત્ન કરો.

૧૫. ઝર

- 👉 વ્યક્તિએ ક્યા પ્રકારનું ઝર ? કેટલું ? અને ક્યારે લીધું છે ? તે જાણવા કોશીશ કરો.
- 👉 ઈમરજન્સી વખતે આ માહિતી હોવી જરૂરી છે.
- 👉 ઝડપથી ૧૦૮ ને ફોન કરો અથવા અન્યને આમ કરવા કહો.
- 👉 કદાચ લીધેલી વસ્તુ ખુબજ નુકશાનકારક હોઈ ઝડપથી તબીબી સારવારની જરૂર પડે છે.
- 👉 વ્યક્તિને ઉલ્ટી કરાવવી નહીં. ઉલ્ટી કરાવવાથી વ્યક્તિની શાસનળીમાં જ્લોકેજ અને કાંકડમાં નુકશાન થઈ શકે છે.

પ્રશ્ન-૧ ઝર એટલે શું ?

દવાઓ, રસાયણો અને અમુક છોડ કે જે ગળવાથી માનવશરીરને નુકશાન થાય

પ્રશ્ન-૨ વ્યક્તિએ ઝર લીધું છે, તેના નિશાની અને લક્ષણો શું-શું હોઈ શકે ?

વ્યક્તિને ઉલ્ટી થાય કે પેટમાં દુખાવો થાય. આસપાસમાં જોવા મળતી પીધેલા ઝેરની ખાલી દાબડી કે શીશી.

પ્રશ્ન-૩ વ્યક્તિને ઉલ્ટી શા માટે ન કરાવવી જોઈએ ?

જો તેને કંઈ દાહક પદાર્થ પીધો હોય તો, શાસમાર્ગમાં બ્લોક, સોજો કે દાઅવાની કીયા થઈ શકે છે જેનાથી વ્યક્તિ ને વધુ દુઃખાવો થઈ શકે છે.

પ્રશ્ન-૪ ૧૦૮ એમ્બ્યુલન્સ આવતા સુધીમાં શું કરવું જોઈએ ?

વ્યક્તિને બેસાડો અને સાંત્વના આપો.

પ્રશ્ન-૫ જો વ્યક્તિ જેભાન થઈ જાય તો ?

જો વ્યક્તિનાં શાસોરણવાસ ચાલું હોય તો રીકવરી પોર્ઝીસનમાં સુવડાવો અને બંધ હોય તો સી.પી.આર. આપો.

પ્રશ્ન-૬ જો વ્યક્તિ એ ઝેર પીધું છે છતા તેના શરીરમાં કોઈ નિશાની અને લક્ષણો દેખાતા નથી તો શું કરવું જોઈએ ?

૧૦૮ ને ફોન કરો અથવા બીજા કોઈને ફોન કરવા કહો.

૧૬. મચકોડ/સનાયુઅ૱નું ખેંચાણ



- 👉 દ્વારા થયેલા ભાગ પર કપડામાં વીટળાયેલો બરફ
એ એવું કંઈ મુકો.
- 👉 આનાથી સોજો અને દુઃખાવો ઓછા થશે.
- 👉 જો આમ કરવાથી રાહત ન જણાય તો તુર્ટંજ
વ્યક્તિને તબીબી સારવાર માટે રીફર કરો.

પ્રશ્ન-૧ મચકોડ અને સ્નાયુઓમાં ખેંચાણનાં નિશાની અને લક્ષણો શું હોઈ શકે છે ?

જ્યારે શરીરનાં કોઈ ભાગનું ઓચીંતુ હલન-ચલન થાય
ત્યારે મચકોડ કે સ્નાયુઓનું ખેંચાણ થાય છે. વ્યક્તિને
સાંધા કે સ્નાયુઓનાં ભાગમાં જ્યાં ઈજા થઈ હોય ત્યાં
દુખાવો અને સોજો જોવા મળે છે. જો ઈજા સાંધા પાસે
થઈ હોય તો, વ્યક્તિને હલન-ચલન કરવામાં ખુબજ
મુશ્કેલી પડે છે.

પ્રશ્ન-૨ જે બરફ ન હોય તો શું કરી શકાય ?

બરફની જગ્યાએ, ઠંડા શાકભાજુ વગેરે ને રમાલ કે
ટુવાલ વગેરેમાં વીંટાળી શકાય.

પ્રશ્ન-૩ આઈસ-પેકને ઈજા થયેલા ભાગ પર વધુમાં વધુ કેટલો સમય મુકી શકાય ?

પ્રાથમિક સારવાર માર્ગદર્શિકા પ્રમાણે ઈજા થયેલા ભાગ
પર આઈસ પેક ૨૦ મિનીટથી વધુ સમય સુધી ન મુકી
શકાય.

પ્રશ્ન-૪ આઈસ પેક મુક્યા પછી આપણે શું કરવું જોઈએ ?

ઈજા થયેલી ભાગ ને થોડો ઉપર રહે તે રીતે રાખી તેના પર પાટો બાંધો. ચાદ રાખો – પાટો સખત ન હોવો જોઈએ આ માટે અવારનવાર ચેક કરતા રહો.

પ્રશ્ન-૫ શું મચકોળની પ્રાથમિક સારવાર માં રાઈસ પદ્ધતીનો ઉપયોગ કરી શકાય ?

હા, RICE પદ્ધતી એટલે,

Rest-આરામ

Ice-બરફ



Comfortable Support (such as an elasticated bandage)-ટેકો આપવો

ઈજા થયેલા ભાગને ઉંચો કરવો

પ્રશ્ન-૬ શું આપણે એમ્બ્યુલન્સને બોલાવવી જોઈએ ?

મોટા ભાગો, ઈજા થયેલા ભાગ પર આઈસ પેક (બરફ) મુકવાથી આરામ મળી રહે છે. જો ફેક્ચર કે વધુ ઈજાની શક્યતા જણાતી હોય તો, તુર્ચંત જ વ્યક્તિને તબીબી સારવાર માટે ચીફર કરવો.

**પ્રશ્ન-૭ શું આવા વખતે ઈજાગ્રસ્ત ભાગને વારાફરતી ઠંડો
અને ગરમ કરવામાં આવે છે તે સાચું છે ?**

પ્રાથમિક સારવારમાં ફક્ત આઈસ પેક કે ઠંડુ કરવાની જ
ભલામણ કરવામાં આવે છે, ક્યારેય પણ શોક કરવો નહીં.

પ્રશ્ન-૮ સ્ટ્રેઇન અને સ્પ્રેઇનમાં શું તફાવત છે ?

જ્યારે સ્નાયુઓમાં ઈજા પહોંચે તેને સ્પ્રેઇન અને સાંધાઓમાં
ઈજા પહોંચે તેને સ્ટ્રેઇન કહે છે.



૧૭. પ્રાથમિક સારવારની પેટી



પ્રાથમિક સારવારની પેટીએ સ્થાનિક જરૂરિયાત તેમજ પ્રાથમિક મદદ કરનારનાં જ્ઞાન અને આવડત મુજબ જુદી-જુદી બનાવાય છે.

ચાદ રાખો :-

- 👉 પ્રાથમિક સારવારની પેટીમાં જરૂરીયાતની ચીજો સુવ્યવસ્થિત રીતે ગોઠવાયેલી હોવી જોઈએ.
- 👉 દરેક વપરાશ પછી ખુટટી ચીજ તાત્કાલીક ભરી લેવી.
- 👉 પ્રાથમિક સારવારની વસ્તુ સાથે અન્ય આવશ્યક ચીજો નો પણ જરૂર હોય તો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ.

- 👉 તેનો પ્રાથમિક સારવાર સિવાય અન્ય કામમાં ઉપયોગ ન કરવો.
- 👉 પ્રાથમિક સારવારની પેટીને હંમેશા હાથવગી રાખવી.



પ્રાથમિક સારવારની પેટીનાં પ્રકારો

- 👉 નાની : ઘર, શાળા, દુકાન, કાર, કે પ્રવાસમાં જતી સમયે.
- 👉 મધ્યમ : મધ્યમ કદનાં કારખાનાઓ માટે તેમજ કીકેટ મેચ, પગાપાળા સંદ્ય અને મેળાઓ વખતે.
- 👉 મોટી : મોટા કદનાં કારખાનાઓ માટે.


પ્રાથમિક સારવારની પેટીની મુખ્ય સાધન સામગ્રી

૧. કીટ (બેગા, પેટી કે બગાલ થેલો)
૨. કીટમાં રહેલા સાધનોની યાદી

૩. સ્થાનિક ઈમરજન્સી નંબરોની યાદી
૪. નજુકનાં સગા સંબંધીઓની યાદી
૫. નોટબુક અને પેન
૬. ટોર્ચ (બેટરી સેલ સાથે)
૭. મીએબતી
૮. માચીસ
૯. જંતુરહિત હાથ મોજા
૧૦. સેફ્ટી ગોગલ્સ
૧૧. ચહેરાનું માર્ક
૧૨. આંગળા, હાથ પગનાં માપની જંતુરહિત પછ્ચીઓ
૧૩. દાખવા પર લગાવવા માટેની જંતુરહિત પછ્ચીઓ
૧૪. બેન્ડ એંડ
૧૫. ૫ ૫ અને ૭.૫ ની સાઈઝનાં રોલર પાટા
૧૬. ટ્રિકોણાકાર પાટા
૧૭. એડહેસીવ પાટો
૧૮. જંતુરહિત ૩
૧૯. આંખ માટેના ગોળ પીસ
૨૦. એડહેસીવ પ્લાસ્ટર
૨૧. સેફ્ટી પીન
૨૨. જેન્સન વાયોલેટ (કોઈપણ એન્ટીસેપ્ટિક દા.ત. ડેટોલ સેવલોન)
૨૩. ઓ આર એસ પેકેટ

- ૨૪. ૧૨.૫ સેમિ સાઈઝની કાતર
- ૨૫. સીપીઆર માર્ક
- ૨૬. ચિપિયો
- ૨૭. હાથ અને પગને ટેકો આપવા માટે લાકડાની સ્પિલન્ટ
- ૨૮. આંખો સાફ્ કરવા માટેનો કપ (આઈવોશ કપ)
- ૨૯. પ્રાથમિક સારવારની માર્ગદર્શિકા

૧૮. માનવ શરીર રચના અને તેના કાર્યો



પ્રાથમિક સારવાર
આપનાર વ્યક્તિને
શરીરનાં અવયવોનાં
સ્થાન તેમની સંખ્યા,
રચના તથા કાર્ય
વિશેનો સાધારણ ખ્યાલ
હોવો જરૂરી છે.
શરીરના બંધારણમાં
હાડકા, સનાયુઓ
(માંસપેશીઓ), લોહીની
નળીઓ, ચેતાતંત્ર નીચે
તાઓ (નર્વ્ઝ), સંયોજક

પેશીઓ (કનેક્ટિવીટીસ્યુઝ), અને ચામડી મુખ્યત્વે ભાગ ભજવે છે.

શરીરના સંચાલનમાં શરીરનાં જુદા-જુદા વિભાગો (તંત્રો) મુખ્ય ભૂમિકા ભજવે છે. આ તંત્રોમાં ચેતાતંત્ર, પાચનતંત્ર, શ્વસનતંત્ર, રૂધિરાભિસરણતંત્ર, કંકાલતંત્ર, સનાયુતંત્ર, ઉત્સર્જનતંત્ર અને પ્રજનનતંત્ર એ મુખ્ય છે.

કંકાલતંત્ર

અસ્થિઓ (હાડપીંજર)

માનવશરીરમાં કુલ ૨૧૩ હાડકાં હોય છે.

હાડપીંજરનાં કાર્યો :-

હાડકાં શરીરને આકાર અને મજબુતાઈ આપે છે. સ્નાયુ શરીરના હલન-ચલનમાં મહત્વનો ભાગ ભજવે છે. સ્નાયુ તથા પેશીઓને આધાર આપી શરીરનું માળખું બનાવે છે. શરીરનાં નાજુક અવયવો જેવાકે, મગાજ, હૃદય, લીવર (ચક્કા), બરોળ અને કીડનીને રક્ષણ આપવાનું કામ કરે છે.

હાડકાનાં પોલાણમાંનો બોન્ડમેરો શરીરનાં લોહીમાં ના કણોનું ઉત્પાદન કાર્ય કરે છે.

સાંધા :

બે કે ગ્રણ હાડકા એકબીજાનાં સંસર્ગમાં આવી જે વિશિષ્ટ રચના કરે છે, તેને સાંધા કહેવાય છે.


૧. સ્થિર સાંધા
૨. ચલિત સાંધા

સ્નાયુઓ

સ્નાયુઓ એ ઘણાબધા તાંત્રણાઓ(fibers) નો સમૂહ છે. શરીરના અવયવોનાં હલન ચલન અને તેમની કીયા સ્નાયુ ઢારા થાય છે. સ્નાયુઓ બે પ્રકારનાં હોય છે.

૧. સ્વૈચ્છિક સ્નાયુઓ : જે આપણી દીર્ઘા પ્રમાણે કામ કરે છે. દા.ત. પગાના સ્નાયુઓ
૨. અનૈચ્છિક સ્નાયુઓ : જે આપણી દીર્ઘા પ્રમાણે કામ કરતા નથી. દા.ત. હૃદયનાં સ્નાયુઓ, પાચનતંત્ર અને ઉત્સર્જનતંત્રના સ્નાયુઓ.


શાસનતંત્ર :



મનુષ્યનું જીવન ટકાવી
રાખવા માટે હવામાંનો
પ્રાણવાયુ(ઓક્સીજન) જરૂરી છે.
પુખ્ત વયની વ્યક્તિમાં
શાસોચ્છવાસની પ્રકીયા દર

એક મિનીટે ૧૫ થી ૨૦ વખત થાય છે.

હવામાંનો પ્રાણવાયુ શ્વાસનળી મારફતે ફેફસામાં જાય છે.
ત્યાંથી લોહીની નળી મારફતે તે હૃદય અને ત્યાંથી શરીરનાં
જુદા જુદા અંગોમાં જાય છે. તેજ રીતે બધા અંગોમાંથી.



આવતો કાર્బનડાયોક્સાઈડ વાયુ ફેફસા દ્વારા ઉચ્છવાસમાં
બહાર નીકળે છે.


શ્વાસનકીયામાં અવરોધ ઉભો થાય તો શરીરના અંગોને
ઓક્સિજન મળે નહી અને મૃત્યુ થઈ શકે છે. આવા વખતે
અવરોધ દુર કરી ફુફ્રીમ શ્વાસોચ્છવાસ આપી શકાય છે.

ઉત્સર્જનતંત્ર :

શરીરમાંથી અશુદ્ધીઓ સાફ કરી તેને દુર કરવાનું કાર્ય કરે છે. જેમાં મુત્રપીડ તથા ચામડી મુખ્ય છે.


પાચનતંત્ર :

મો દ્વારા ખાદ્યેલો ખોરાક જુદી જુદી પ્રક્રીયામાંથી પસાર થાય અને તેમાંથી વધેલો કચરો મળ માર્ગ બહાર આવે છે. ખોરાક પાચનની પ્રક્રીયામાં પાચનતંત્રના જુદા જુદા અવયવો જેવા કે માં, અક્ષનળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું, મળમાર્ગ, વગોરે કાર્ય કરે છે. જેમાંથી ઝરતાં પાચન રસો આ પ્રક્રીયામાં ભાગ લે છે.



લઘિરાભિસરણતંત્ર : હૃદય- લોહિનું પરિભ્રમણ

લોહી આપણા શરીરનાં બધા જ અંગોને પ્રાણવાયુ (ઓક્સિજન) તથા ઉપયોગી તત્વો પહોંચાડવાનું કાર્ય કરે છે હૃદય આ લોહીને જુદા જુદા અંગો સુધી પહોંચાડવા માટેના યંત્રનું કાર્ય કરે છે. ફેફસા



લોહી શરીરનાં અંગારોને
પહોંચાડવામાં આવે છે. અને
અંગોનું અશુદ્ધ લોહિ શિરાઓ
મારફતે ફેફસામાં શુદ્ધથવ આવે છે.

સામાન્ય રીતે તંદુરસ્ત અને પુષ્ટ
વયનાં પુરુષોમાં પાંચ થી છ
લીટર તેમજ સ્ત્રીઓમાં ચાર થી
પાંચ લીટર લોહી હોય છે.

નાડીના ઘબકારા :

હૃદય જ્યારે સંકોચાય ત્યારે તેમાં એકદુષ્ટ થયેલું લોહી
ધમનીઓ મારફતે શરીરનાં વિવિધ અંગોમાં પહોંચે છે.



ધમનિની દીવાલ સ્થિતીસ્થાપક
હોવાથી હૃદયના સંકોચનથી
ઉત્પન્ન થતું દબાણ નાડીના
ઘબકારા ઝે અનુભવી શકાય છે.

સામાન્ય રીતે નાડીના

ધબકારા કંડાની આગાળની બાજુએ અંગુઠા તરફ ત્રણ આંગાળીનું દબાણ આપવાથી માપી શકાય છે. જેને રેડીયલ પલ્સ કહે છે.

સામાન્ય રીતે વ્યાયમ દરમ્યાન અથવા વિવિધ લાગાણીના આવેગ વખતે નાડીના ધબકારા વધી જાય છે. મન શાંત હોય ત્યારે તથા આરામની પળોમાં ધબકારા ઓછા હોય છે. તાવમાં, ઈજાને લીધે, શરીરનું લોહી વહિ ગયું હોય તેવા સંજોગોમાં અથવા એનિમિયા વગેરેમાં નાડીનાં ધબકારા વધી જાય છે.



જ્ઞાનતંત્ર :

શરીરની બધી કીયાઓ જ્ઞાનતંત્ર મારફતે થાય છે. જ્ઞાનતંત્રમાં મુખ્યત્વે મગાજ, કરોડરજ્જુ, અને જ્ઞાનતંત્રુઓનો સમાવેશ થાય છે. મગાજ કે કરોડરજ્જુને થતી ઈજા ખુબજ જોખમી હોય છે. કારણકે તેનાથી કાયમી ખોડ રહેવાની અથવા જાન ગુમાવવાની નોભત આવી શકે છે.

રેડ કોસનાં સાત મૂળભૂત સિદ્ધાંતો

👉 માનવતા



👉 નિષ્પક્તા



👉 તટસ્થતા



👉 એકતા



👉 સ્વયંસેવા



👉 સ્વતંત્રતા



👉 ધેશ્યકતા



-: પ્રયોજક અને પ્રકાશક :-
ઇન્ડીયન રેડ ક્રોસ સોસાયટી
ગુજરાત રાજ્ય શાખા



“રેડ ક્રોસ ભવન” જુના વાડજ સર્કલ, અમદાવાદ-૩૮૦૦૧૩
ફોન : ૦૭૯-૨૭૫૫૭૦૫૫/૫૬, ૦૭૯-૨૭૫૫૮૨૩૦
Email : ircsguj@hotmail.com
Web : www.redcrossgujarat.org